

ગુજરાત યુનિવર્સિટી



નં. પરીક્ષા/3-બ/એનરોલમેન્ટ/૮૨૧૯/૨૦૨૨
ગુજરાત યુનિવર્સિટી કાર્યાલય,
નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૮
તા : ૨૧/૦૫/૨૦૨૨

પરિપત્ર ક્રમાંક : ૧૯૮

ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી મેડિકલ, ટેન્ટલ, ફિઝિયોથેરાપી, હોમિયોપેથી, નર્સિંગ, પ્રોસ્થોટિક્સ એન્ડ ઓર્થોટિક્સ, ઓપ્ટોમેટ્રી, ઓક્સિપેશનલ થેરાપી, ઓડીયોલોજી એન્ડ રિપ્ચ વિદ્યાશાખાઓની તમામ કોલેજોના આચાર્ય/અધ્યક્ષશ્રીનું આ યુનિવર્સિટીના ઓડિ. ફલ તરફ ધ્યાન દોરી જણાવવાનું કે, આપની સંસ્થા/કોલેજમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ ફોર્મ ઓનલાઈન ભરી તથા ફી. વિદ્યાર્થીઓ પાસેથી ભરાવી, વિદ્યાર્થીઓની માહિતી નિયત પત્રક સાથે આ કાર્યાલયને તા: ૧૩/૦૬/૨૦૨૨ સુધીમાં જમા કરાવવા જણાવવામાં આવે છે.

ત્યારબાદ એનરોલમેન્ટ ફોર્મ તા: ૨૦/૦૬/૨૦૨૨ સુધી રૂ. ૫૦૦/- અને તા: ૨૭/૦૬/૨૦૨૨ સુધી રૂ. ૧૦૦૦/- બેઠી ફી સાથે સ્વીકારવામાં આવશે. ત્યારબાદ માન. કુલપતિશ્રી દ્વારા નિયત દંડનીય ફી સિવાય કોઈ જ એનરોલમેન્ટ ફોર્મ રિવકારવામાં નહીં આવે. જેની ખાસ નોંધ લેશો.

આ ફોર્મ ઓનલાઈન ભરવાના હોઈ રોલવાલા કોમ્પ્યુટર સેન્ટરના વડાશીનો સંપર્ક સાધવો. એનરોલમેન્ટ ફોર્મ યુનિવર્સિટી કાર્યાલયમાં જમા કરાવવા માટે મોકલતા અગાઉ નીચેની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા વિનંતી છે. (રોલવાલા કોમ્પ્યુટર સેન્ટર સંપર્ક : ૦૭૯-૨૬૩૦૦૮૭૭)

૧. એનરોલમેન્ટ ની વિગતો ભરવા માટે કોલેજ ને આપવામાં આવેલ Login Id અને Password દ્વારા Login કરવાનું રહેશે.

અ. જે તે કોલેજના Loginમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની વિગતો જોવા મળશે. કોલેજ દ્વારા જે તે ઉમેદવારની વિગતો ચકાસવા માટે Prefilled Enrolment Form પ્રિન્ટ કરી, તેમાં જે વિગત ભરેલ ના હોય અથવા માહિતી સુધારવાની થતી હોય તે વિગત ઉમેદવાર પાસે ભરાવી/સુધારવી. Online સુધારો કોલેજે કરવાનો રહેશે.

બ. જે વિદ્યાર્થીઓની કોઈ પણ માહિતી Prefilled Enrolment Formમાં ન હોય, તે માટે કોલેજ Blank Enrolment Form Print કરી વિદ્યાર્થીઓ પાસે સંપૂર્ણ માહિતી ભરાવીને તે ફોર્મની online Entry કરવી. ત્યારબાદ તે online Enrolment Formની Print કાઢીને જે તે વિદ્યાર્થી પાસે ભરાઈ કરાવવી અને કોઈ માહિતી સુધારવાની થતી હોય તો તે વિદ્યાર્થી પાસે સુધારવી. Online સુધારો કોલેજે કરવાનો રહેશે.

ઉપર 'અ' અને 'બ' મુજબ કોલેજે ઓનલાઈન સુધારા કર્યા બાદ Enrolment Formની પ્રિન્ટ કરી જે તે વિદ્યાર્થી અને પ્રિન્સિપાલની સહી કરાવી યુનિવર્સિટી ખાતે પ્રત્યેક વિદ્યાર્થી દીઠ ફોર્મ ફી રૂ.૨૫/- અને એનરોલમેન્ટ ફી રૂ. ૧૦૦/-ભરવાની રહેશે.

ખાસ સૂચના : દરેક કોલેજે જે-તે વિદ્યાર્થનિ માત્ર તે વિદ્યાર્થીનું જ Prefilled Enrolment Form ચકાસવા આપવું. Prefilled Enrolment Formની આખી PDF કોઈ વિદ્યાર્થનિ ન આપવી, તેમજ સોશયલ મીડિયામાં શેર ના કરવી.

2. વિદ્યાર્થીઓ જયારે એનરોલમેન્ટ માટે અરજી કરે ત્યારે તેમાં તેનું નામ, છેલ્લે પાસ કરેલ હાયર સેકન્ડરી પરીક્ષાના ગુણપત્રક પ્રમાણે જ ભરે, તેમજ બેઠક નંબર પણ સાચો દર્શાવે તેવી સૂચના વિદ્યાર્થીઓને આપવી તેમજ જરૂર જગ્યાય તો નોટિસ બોર્ડ પર આ પ્રકારની જરૂરી સૂચના મૂકવી, જેથી કોમ્પ્યુટર ચેકિંગમાં ક્ષતિઓ ઓછી આવે.
3. એનરોલમેન્ટ ફોર્મ ફી માટે કોસ્ટ ચેક/ડિમાન્ડ ડ્રાફ્ટ/પે. ઓર્ડર “કુલસચિવશ્રી, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ-૩૮૦૦૦૮” ને મોકલી આપવો. ડિમાન્ડ ડ્રાફ્ટ /પે. ઓર્ડર બેંક કમિશનની રકમ બાદ કરી કઢાવવાનો રહેશે.
4. આ કાર્યાલયના તા. ૨૬-૦૨-૨૦૧૪નાં પત્રાંક: એક્ઝેક્યુટિવ/૮૮૪૧૦/૨૦૧૪નાં સંદર્ભમાં જગ્યાવવાનું કે સેલ્ફ ફોર્મનાન્સ કોલેજોએ ડેવલોપમેન્ટ ફી એ એનરોલમેન્ટ ફી સાથે જ જમા કરાવવાની થાય છે. આથી એનરોલમેન્ટ ફોર્મ સાથે ડેવલોપમેન્ટ ફી અંગે અલગથી ફોર્વર્ડિંગ પત્ર અને તે રકમનો ડ્રાફ્ટ લાવવાનો રહેશે. આ ડેવલોપમેન્ટ ફી વિના એનરોલમેન્ટ ફી સ્વીકારવામાં આવશે નહિ જેની ખાસ નોંધ બેશો.
5. વિદ્યાર્થીઓ પાસેથી ભરાવેલા એનરોલમેન્ટ ફોર્મ ઉપર કમાંક ૧માં આપેલ સૂચના મુજબ Enrolment Formની પ્રિન્ટ કરી જે તે વિદ્યાર્થી અને પ્રિન્સિપાલની સહી કરવી યુનિવર્સિટી ખાતે પ્રત્યેક વિદ્યાર્થી દીઠ ફોર્મ ફી રૂ.૨૫/- અને એનરોલમેન્ટ ફી રૂ.૧૦૦/-ભરવાની રહેશે, ફોર્વર્ડિંગ લેટર સાથે જનરેટ થયેલ યાદીની બે નકલ સાથે આ કાર્યાલયમાં નિયત તારીખ સુધીમાં જમા કરાવવાના રહેશે.
6. એડમિશન કમિટી માર્ક્યુન્ટ પ્રવેશ મેળવ્યો હોય તેવા તમામ વિદ્યાર્થીઓની યાદી ને ૧ થી કમાંક આપી અલગથી જમા કરાવવી.
7. એડમિશન કમિટી માર્ક્યુન્ટ પ્રવેશ ન મેળવ્યો હોય તેવા તમામ વિદ્યાર્થીઓની યાદી ને ૧૦૦૧ થી કમાંક આપી અલગથી જમા કરાવવી.
8. એડમિશન કમિટી માર્ક્યુન્ટ પ્રવેશ ન મેળવ્યો હોય તેવા તમામ વિદ્યાર્થીઓએ HSCની પરીક્ષા સરકાર/UGC માન્ય બોર્ડમાંથી પાસ કરેલ છે તેની ચકાસણી સંસ્થાના વડાશ્રીએ કરવાની રહેશે. પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનું બોર્ડ સરકાર માન્ય નહીં હોય તો તેઓને આપેલ પ્રવેશ ગમે ત્યારે રદ થવાને પાત્ર છે તેવી જાણ સંસ્થાએ વિદ્યાર્થીની પણ કરવાની રહેશે અને આ અંગેની સધળી જવાબદારી પ્રવેશ આપનાર સંસ્થાની રહેશે.

ડૉ. પી. એમ. પટેલ
કુલસચિવ

પ્રતિ:

1. યુનિવર્સિટી સંલગ્ન મેડિકલ, ડેન્ટલ, ફિઝિયોથેરાપી, હોમિયોપેથી, નર્સિંગ, પ્રોસ્થોટિક્સ એન્ડ ઓર્થોટિક્સ, ઓપ્ટોમેટ્રી, ઓક્સ્યુપેશનલ થેરાપી અને ઓડિયોલોજી એન્ડ સ્પિચની તમામ કોલેજોના આચાર્ય/અધ્યક્ષશ્રીઓ.
2. પૂછપરછ વિભાગ (ત્રણ નકલ)
3. ચીક્સ એકાઉન્ટસ ઓફિસર, હિસાબ વિભાગ, ગુજરાત યુનિવર્સિટી.

નોંધ: પ્રવેશ અંગેની તમામ કાર્યવાહી થઈ ગયા પછી જ એનરોલમેન્ટ માટે ડી.ડી. તૈયાર કરશો. જેથી ફોર્મ અને ડી.ડી.માં એકરૂપતા જગ્યાવાઈ રહે.

દરેક એનરોલમેન્ટ ફોર્મની સાથે નીચે જગ્યાવ્યા પ્રમાણેના દસ્તાવેજો બિડવાના રહેશે.

1. એડમિશન/એલોટમેન્ટ લેટર
2. HSC માર્કશીટ
3. સ્કૂલ લિલિંગ સર્ટિફિકેટ
4. NEET સ્કોર કાર્ડ (એમબીબીએસ, બીડીએસ અને બીએચએમએસ માટે)